

૩૦ મા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ (અમદાવાદ શહેર) સાહેબની કોર્ટ સમક્ષ.

અરજદારની કિમીનલ પરચુરણ અરજીઓના કામે બી. એન. એસ. એસ. ની

કલમ-૪૯૭ અને ૫૦૩ ની અરજી લગત હુકમ.

- (૧) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૨૫/૨૦૨૪
- (૨) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૨૬/૨૦૨૪
- (૩) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૨૭/૨૦૨૪
- (૪) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૨૮/૨૦૨૪
- (૫) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૨૯/૨૦૨૪
- (૬) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૩૦/૨૦૨૪
- (૭) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૩૧/૨૦૨૪
- (૮) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૩૨/૨૦૨૪
- (૯) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૩૫/૨૦૨૪
- (૧૦) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૩૬/૨૦૨૪
- (૧૧) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૩૭/૨૦૨૪
- (૧૨) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૩૮/૨૦૨૪
- (૧૩) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૪૦/૨૦૨૪
- (૧૪) કિમીનલ પરચુરણ અરજી નં.૧૩૬૪૧/૨૦૨૪
- (૧૫) કિમીનલ પરચુરણ અરજી નં. ૧૩૬૪૨/૨૦૨૪

- (૧) આ કામે દર્શાવેલ તમામ અરજીઓના અરજદાર એક જ વ્યક્તિ છે કે જેઓએ બેંકમાં ફીઝ થયેલ રકમ મુક્ત કરવા માટે અરજીઓ આપેલ છે જેથી તમામ અરજીઓની વિગત ધ્યાને લેતાં એક જ પ્રકારની અરજી હોય તેથી તમામ અરજીઓનો કોમન ઓર્ડર કરવામાં આવેલ છે.
- (૨) અરજદારની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિધ્વાન એ.પી.પી.શ્રીને સાંભળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.
- (૩) હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે તેઓ અરજીમાં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ, જે બનાવમાં તેઓના BANK OF BARODA બેંકના ખાતા નં.15960100006337 માંથી રૂ.10,33,681.1499/- તથા BANK OF INDIA બેંકના ખાતા નં.9428100505010 માંથી રૂ.1,43,650/- ઉપડી ગયેલ હતાં. જે બાબતે તેઓએ ૧૯૩૦ નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવેલ હતી. જે ફરિયાદ તા.19/01/2024 ના રોજ 31101240010130 નંબરથી નોંધાયેલ હતી જે

સબબ સાયબર ફ્રાઈમ પોલીસ ધ્વારા સામાવાળાના (૧) IDBI BANK ના ખાતા નં.
 1626104000075314 IFSC:IBKL0001626 માં તેઓના ગયેલ નાણાં પૈકી
 રૂ.4,600/- તથા (૨) BANK OF BARODA ના ખાતા નં. 01570500006529
 IFSC:BARB0UNJHAX માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.7,500/- તથા (૩)
 BANK OF BARODA ના ખાતા નં. 01570500006529
 IFSC:BARB0UNJHAX માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.7,500/- તથા (૪)
 UCO BANK ના ખાતા નં. 11260100011613 માં તેઓના ગયેલ નાણાં પૈકી
 રૂ.11,000/- તથા (૫) ICICI BANK ના ખાતા નં. 015801549857
 IFSC:ICIC0000158 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.13,000/- તથા (૬)
 BANK OF BARODA ના ખાતા નં. 56590100007329
 IFSC:BARB0PIPLOD માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.6,300/- તથા (૭)
 STATE BANK OF INDIA ના ખાતા નં. 11020429241
 IFSC:SBIN0011455 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.1,700/- તથા (૮)
 STATE BANK OF INDIA ના ખાતા નં. 30210428604A112858
 IFSC:SBIN0009995 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.1,500/- તથા (૯)
 BANK OF BARODA ના ખાતા નં. 11450100023282
 IFSC:BARB0SELAMB માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.5,000/- તથા (૧૦)
 CENTRAL BANK OF INDIA ના ખાતા નં. 00000003765130176
 IFSC:CBIN0280551 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.2,000/- તથા (૧૧)
 STATE BANK OF INDIA ના ખાતા નં. 00000041015424065
 IFSC:SBIN0032132 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.1,000/- તથા (૧૨)

AXIS BANK ના ખાતા નં. 920020058381905 IFSC:UTIB0000078 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.10,400/- તથા (૧૩) BANK OF BARODA ના ખાતા નં. 07580100013771 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.1,000/- તથા (૧૪) BANK OF BARODA ના ખાતા નં. 49928100006874 IFSC:BARB0MANBAG માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.5,000/- તથા (૧૫) BANK OF INDIA ના ખાતા નં. 884110110001980 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.34,900/- ઉપર મુજબની રકમો ધી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેંકમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે આ બાબતે એફ.આઈ.આર. થયેલ નથી. તેઓને ખુબ જ મોટું આર્થિક નુકસાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે બી. એન. એસ. એસ. ની કલમ-૪૯૭ અને ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

- (૩) અરજદારની અરજીઓ સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે નાયબ પોલીસ અધિક્ષક, સાયબર ક્રાઈમ સેલ, સી. આઈ. ડી. ક્રાઈમનાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહિત સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા હુકમ કરવામાં આવેલ.
- (૩.૧) જે અન્વયે ત.ક.અધિકારીએ તેઓનો અભિપ્રાય રજૂ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતાં તેઓએ જણાવેલ છે કે સાયબર ક્રાઈમનો ભોગ બનનારના નાણાં જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતાં હોય છે ત્યારે આવા નાણાંને તાત્કાલિક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સામાન્ય નાગરિકો માટે શરૂ કરવામાં આવેલ છે, જે હાલ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી ક્રાઈમ હસ્તક ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઈમ ઈન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટમાં સાયબર ક્રાઈમનો ભોગ બનનારના નાણાં જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતાં હોય છે ત્યારે તેને તાત્કાલિક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઈમના ભોગ બનનાર નાગરિકો સીધી જ પોતાની ફરિયાદ ૧૯૩૦ પર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઈન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટિકિટ નંબર આપવામાં આવે છે તેમજ સાથોસાથ જે શંકાસ્પદ બેંક

ખાતામાં જે તે નાગરિકના નાણાં ગયેલ હોય તે બેંકને નાણાં ફીઝ કરાવવા તેમજ જો નાણાં ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહિતી આપવા માટે તેઓની કચેરીએથી બી. એન. એસ. એસ. ની કલમ-૯૪ તથા ૧૦૬ હેઠળ નોટીસ આપવામાં આવે છે. નોટીસના આધારે બેંકો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણાં ફીઝ કરવામાં આવે છે.

(૩.૨) તપાસ કરનાર અધિકારીએ વધુમાં જણાવેલ છે કે હાલના અરજદારશ્રી નાઓ સાથે સાચબર ક્ષાઈમનો બનાવ બનેલ હતો. જેમાં અરજદારના ખાતામાંથી સામાવાળાના ખાતામાં જે રકમો ફીઝ કરવામાં આવેલ છે. વધુમાં, અરજદારની ફરિયાદના આધારે તેઓએ ૧૯૩૦ નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવેલ હતી. જે ફરિયાદ આધારે અરજદારને ટિકિટ નં. 31101240010130 આપવામાં આવેલ. આ અરજદારની ફરિયાદ આધારે સાચબર ક્ષાઈમ સેલ સી.આઈ.ડી.ક્ષાઈમ દ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણાં પૈકી સામાવાળા શંકાસ્પદ ખાતાઓમાં તેઓના ગયેલ નાણાં જે રકમ બી. એન. એસ. એસ. કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણાં પાછા ખેંચવા માટે અરજદારશ્રીએ નામદાર કોર્ટમાં અરજી કરેલ હોય અને સાડૂ તેઓનો અભિપ્રાય માંગેલ છે જે બાબતે તેઓએ જણાવેલ છે અરજદારશ્રીનાઓના સામાવાળાના શંકાસ્પદ બેંક ખાતુ છે તેમાં તેઓના ગયેલ નાણાં પૈકી જમાં થયેલ રકમ બનાવટી બેંક ખાતુ હોવાનું જણાયેલ છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ(પોલીસ) સમક્ષ કોઈ વાંધો તકરાર લીધેલ નથી. જેથી તે રૂપિયા અરજદારશ્રીને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

(૪) સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેંક પેપર્સની નકલ ધ્યાને લેતાં તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતાં તે હકીકત સ્પષ્ટ થાય છે કે હાલના અરજદારના BANK OF BARODA બેંકના ખાતા નં.15960100006337 માંથી રૂ.10,33,681.1499/- તથા BANK OF INDIA બેંકના ખાતા નં.9428100505010 માંથી રૂ.1,43,650/- ઉપડી ગયેલ રકમ જે ઉપરોક્ત કરેલ ચર્ચા મુજબ સામાવાળાના બેંક ખાતામાં ફીઝ થયેલ છે તે રકમ બાબતે સદર હકીકત ધ્યાને લેતાં અરજદારના ઉપર જણાવ્યા મુજબના ખાતામાંથી નાણાં ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયાનું

હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદઉપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતાં હાલના કામે આજદિન સુધી કોઈ એફ.આઈ.આર. થયેલ હોય કે હાલના કામે કોઈની ઘરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ આવતું નથી. તેમજ બનાવ બન્યાને આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદિન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાંની અત્રેની અદાલત સમક્ષ માંગણી કરતી કોઈ અરજી કરેલ નથી. તદઉપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતાં તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાંની માંગણી કરેલ હોય તેમ જણાતું નથી તેમજ તપાસ કરનાર અમલદાર ધ્વારા સદર બેંક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી. જેથી, તપાસ કરનાર અમલદાર ધ્વારા સદર નાણાં અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાંનો કબજો મેળવવા હકકદાર હોવાનું જણાય છે.

- (જ.૧) આમ, સદર કેસની તમામ હકીકતો, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતાં સદર નાણાં બેંકમાં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમજ ભવિષ્યમાં પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં બી. એન. એસ. એસ. ની કલમ-૪૮૭ અને ૫૦૩ તથા નામદાર સુપ્રિમ કોર્ટ ધ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩(૧) જી.એલ.એચ. પાના નં.૩૦૭ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતાં તથા ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

- :: હુકમ :: -

- (૧) અરજદારશ્રી હિમાંશુ ઠાકોરલાલ પટેલ ની હાલની અરજીઓ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ ૪૮૭ અને ૫૦૩ હેઠળ મંજૂર કરવામાં આવે છે.
- (૨) અરજદારને સદર ગુનાના કામે સીઝ કરવામાં આવેલ રોકડ રકમ રૂ.1,12,400/-પુરાના દોઢી રકમના જાત જામીન (બોન્ડ) પોલીસ સ્ટેશનમાં આપ્યેથી નીચેની શરતોને આધિન નાણાં પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.
- (૩) વધુમાં હુકમ કરવામાં આવે છે કે અરજદાર ધ્વારા હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) પોલીસ સ્ટેશનમાં આપ્યેથી પોલીસ અધિકારી ધ્વારા તે મતલબની જાણ

તથા સદર હુકમની જાણ જે તે બેંકને કરવી તેમજ (૧) IDBI BANK તથા (૨) BANK OF BARODA તથા (૩) BANK OF BARODA તથા (૪) UCO BANK તથા (૫) ICICI BANK તથા (૬) BANK OF BARODA તથા (૭) STATE BANK OF INDIA તથા (૮) STATE BANK OF INDIA તથા (૯) BANK OF BARODA તથા (૧૦) CENTRAL BANK OF INDIA તથા (૧૧) STATE BANK OF INDIA તથા (૧૨) AXIS BANK તથા (૧૩) BANK OF BARODA તથા (૧૪) BANK OF BARODA તથા (૧૫) BANK OF INDIA ને હુકમ કરવામાં આવે છે કે, તેઓએ પોલીસ અધિકારી ધ્વારા અરજદારે હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા સદર હુકમની જાણ મળ્યેથી દિન-૧૦માં તેમની બેંકના (૧) IDBI BANK ના ખાતા નં. 1626104000075314 IFSC:IBKL0001626 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.4,600/- તથા (૨) BANK OF BARODA ના ખાતા નં. 01570500006529 IFSC:BARB0UNJHAX માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.7,500/- તથા (૩) BANK OF BARODA ના ખાતા નં. 01570500006529 IFSC:BARB0UNJHAX માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.7,500/- તથા (૪) UCO BANK ના ખાતા નં. 11260100011613 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.11,000/- તથા (૫) ICICI BANK ના ખાતા નં. 015801549857 IFSC:ICIC0000158 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.13,000/- તથા (૬) BANK OF BARODA ના ખાતા નં. 56590100007329 IFSC:BARB0PIPLOD માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.6,300/- તથા (૭) STATE BANK OF INDIA ના ખાતા નં. 11020429241 IFSC:SBIN0011455 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.1,700/- તથા (૮) STATE BANK OF INDIA ના ખાતા નં.

30210428604A112858 IFSC:SBIN0009995 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.1,500/- તથા (૯) BANK OF BARODA ના ખાતા નં. 11450100023282 IFSC:BARB0SELAMB માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.5,000/- તથા (૧૦) CENTRAL BANK OF INDIA ના ખાતા નં. 00000003765130176 IFSC:CBIN0280551 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.2,000/- તથા (૧૧) STATE BANK OF INDIA ના ખાતા નં. 00000041015424065 IFSC:SBIN0032132 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.1,000/- તથા (૧૨) AXIS BANK ના ખાતા નં. 920020058381905 IFSC:UTIB0000078 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.10,400/- તથા (૧૩) BANK OF BARODA ના ખાતા નં. 07580100013771 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.1,000/- તથા (૧૪) BANK OF BARODA ના ખાતા નં. 49928100006874 IFSC:BARB0MANBAG માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.5,000/- તથા (૧૫) BANK OF INDIA ના ખાતા નં. 884110110001980 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.34,900/- માં અરજદારના જે કુલ રૂ.1,12,400/-જમા છે તે રકમ અરજદારના BANK OF BARODA બેંકના ખાતા નં.15960100006337 માં જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો.

- (૧) અત્રેની અદાલતના હુકમના આધારે અરજદારને રકમ પરત કરવા હુકમ કરવામાં આવે છે. સદર રકમ બાબતે ભવિષ્યમાં જો કોઈ વાંધો અદાલત સમક્ષ રજુ કરવામાં આવે તો અરજદારે સદર રકમ અદાલત સમક્ષ જમાં કરાવવાની રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણાં પર કલેઈમ કરે અને પોતાનો હકક/હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત

કરવાની રહેશે.

(૩) સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહિત કામે ઉપયોગ કરવો/કરાવવો નહીં.

(૪) કોઈ પણ શરતનો ભંગ થયેથી હાલનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજરોજ તા.૧૪ મી માહે ડિસેમ્બર સને ૨૦૨૪ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી જાહેર કર્યો.

તા.૧૪/૧૨/૨૦૨૪
અમદાવાદ.

(શ્રી બી. પી. મહીડા)
કોડ નં.-૦૧૧૨૨
૩૦ મા એડી.ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ,
અમદાવાદ (શહેર).